

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ

ઘોરણ-૧૨ પછીના (બી-ગ્રુપના) ડિગ્રી કોર્ષમાં પ્રવેશ માટે રૂબરૂ કાઉન્સેલીંગ માટે
ઉપસ્થિત રહેનાર ઉમેદવારો માટે જરૂરી સુચનાઓ

અગત્યની સુચનાઓ

- (૧) કાર્યક્રમ મુજબ રૂબરૂ કાઉન્સેલિંગમાં કેટેગરી મુજબ જે તે કોલેજ માટે બોલાવેલ ઉમેદવારોએ જ જે તે તારીખ અને સમય પ્રમાણે હાજર રહેવાનું રહેશે. અન્ય ઉમેદવારોએ હાજર રહેવાનું નથી.
- (૨) ઉમેદવારોએ નોટીસ બોર્ડ ઉપર દર્શાવેલ ક્લાસ રૂમમાં મેરીટ નંબર મુજબ જ બેસવાનું રહેશે, ઉમેદવાર સાથે વાલીને હોલમાં પ્રવેશ મળશે નહીં. જરૂર પડે તો બહારથી બોલાવી શકાશે. ત્યારબાદ ઉમેદવારોને કોલેજ અને કેટેગરીના મેરીટ નંબર મુજબ રૂબરૂ કાઉન્સેલીંગ માટે કોન્ફરન્સરૂમ / યુજી હોલમાં બોલાવવામાં આવશે.
- (૩) હેલ્પ સેન્ટર ખાતે ફોર્મ ભરતી વખતે જે અસલ પ્રમાણપત્રો રજૂ કરેલ હોય તે જ આધારો તથા વેરીફાઇડ અરજીફોર્મ સાથે રાખવાના રહેશે. તેમજ જો અગાઉના રાઉન્ડમાં ટોકન ફી ભરેલ હોય તો તેનું અસલ ચલણ લાવવાનું રહેશે.
- (૪) મેરીટ નંબર મુજબ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હશે અને ઉમેદવારો મોડા આવશે તો તેવા ઉમેદવારોને જે તે સમયે ચાલતા મેરીટ ક્રમ અને ખાલી રહેલ બેઠકની પરિસ્થિતિ મુજબ પ્રવેશ પ્રક્રિયામાં હાજર ગણવામાં આવશે.
- (૫) પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત સૌ પ્રથમ જનરલ મેરીટ લીસ્ટ મુજબ ઉમેદવારોને ખાલી બેઠકોની સંખ્યા પ્રમાણે જે તે કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે. આ દરમિયાન અનામત કેટેગરીના ઉમેદવાર મેરીટમાં આગળ હશે તો તેમને નિયમોનુસાર જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવશે. પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારને પોતાની પસંદગીની કોલેજમાં મેરીટ મુજબ જનરલ કેટેગરી હેઠળ પ્રવેશ ન મળતો હોય ત્યારે તેમની કેટેગરી હેઠળ તેમની પસંદગી મુજબની કોલેજમાં જે તે કેટેગરીનું મેરીટ લીસ્ટ ધ્યાને લઈ અનામત કેટેગરી હેઠળ પ્રવેશ મેળવી શકશે.
- (૬) રૂબરૂ કાઉન્સેલિંગ દરમિયાન છેલ્લી પરિસ્થિતિ મુજબની ખાલી જગ્યાઓ પર નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે.
- (૭) ક્રમાનુસાર બોલાવેલ ઉમેદવારોને તેમને મળતી કોલેજ ખાતે પ્રવેશ મળે તો તે જ સમયે ફી ભરવાની રહેશે અને જો અન્ય કોલેજમાં પ્રવેશ ઇચ્છતા હોય તો જે તે કોલેજની કેટેગરી વાઇઝ બોલાવેલ ઉમેદવારોની યાદીમાં તેમનો સમાવેશ થયેલ હશે તો જ તે કોલેજ માટેના ઉમેદવારોને જ્યારે બોલાવવામાં આવ્યા હોય તે સમયે હાજર રહેવાનું રહેશે. જે માટે અગાઉની પ્રવેશ મળેલ કોલેજ ખાતેથી તેમનું નામ કાયમી ઘોરણે રદ પાત્ર થશે.

- (૮) પ્રવેશ મેળવ્યા બાદ નીચે દર્શાવેલ ટેબલની વિગતે ફી ભરવાની રહેશે. આ માટે HDFC બેન્કના કાઉન્ટરની વ્યવસ્થા કાઉન્સેલીંગના સ્થળે ગોઠવવામાં આવેલ છે. પ્રવેશ મળ્યા બાદ તાત્કાલિક કાઉન્સેલીંગના સ્થળે જ રોકડા/ક્રેડીટ કે ડેબિટ કાર્ડથી ફી ભરવાની રહેશે. ફી ભરેલ હશે તો જ પ્રવેશ માન્ય ગણાશે તેની નોંધ લેવી.

પ્રવેશ સમયે ભરવાની ફી

ઉમેદવાર	વેટરનરી સિવાયના અભ્યાસક્રમો માટેની ફી		વેટરનરી અભ્યાસક્રમ માટેની વાર્ષિક ફી	
	પ્રથમ વખત પ્રવેશ મેળવેલ ઉમેદવારોએ ભરવાની ફી	અગાઉના રાઉન્ડમાં ટોકન ફી ભરેલ ઉમેદવારોએ ભરવાની ફી	પ્રથમ વખત પ્રવેશ મેળવેલ ઉમેદવારોએ ભરવાની ફી	અગાઉના રાઉન્ડમાં ટોકન ફી ભરેલ ઉમેદવારોએ ભરવાની ફી
ભાઈઓ	રૂ. ૧૩૭૦૦/-	રૂ. ૫૫૦૦/-	રૂ. ૨૧,૨૫૦/-	રૂ. ૫૫૦૦/-
બહેનો	રૂ. ૮૭૦૦/-	રૂ. ૫૫૦૦/-	રૂ. ૧૧,૨૫૦/-	રૂ. ૫૫૦૦/-

- (૯) વિદ્યાર્થીઓ અને વાલીઓએ રૂબરૂ કાઉન્સેલીંગ દરમિયાન રૂબરૂમાં આપવામાં આવનાર સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
- (૧૦) પ્રવેશ મળ્યેથી વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય તે કોલેજમાં દિન-૨ માં હાજર થવાનું રહેશે. ત્યારબાદ જે તે કોલેજમાં હાજર નહીં રહેનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ તેમણે ફી ભરેલ હશે તો પણ પ્રવેશ રદ કરી/ગણી અન્ય ઉમેદવારને નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવશે.
- (૧૧) વિદ્યાર્થીઓએ કાઉન્સેલીંગમાં ઉપસ્થિત રહ્યા સબબ હાજરીપત્રકમાં ફરજિયાત સહી કરવાની રહેશે.
- (૧૨) પ્રવેશ પ્રક્રિયા અંગેના અંતિમ નિર્ણય ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કોમન પ્રવેશ સમિતિનો રહેશે.
- (૧૩) રૂબરૂ કાઉન્સેલીંગ/મુલાકાત માટે બોલાવેલ તમામ ઉમેદવારોને પ્રવેશ મળશે જ તે અંગેની ખાત્રી પ્રવેશ સમિતિ આપતી નથી.
- (૧૪) તમામ ઉમેદવારોએ રૂબરૂ કાઉન્સેલીંગમાં સ્વખર્ચે આવવાનું રહેશે.
- (૧૫) પ્રવેશ માટે કાઉન્સેલીંગનું સ્થળ:
યુ. જી. એકઝામ હોલ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય પાછળ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી, આણંદ.

સહી /-
તા. ૦૬-૦૭-૨૦૧૮
આણંદ

કુલસચિવ
આણંદ કૃષિ યુનિવર્સિટી